

જે તમારે ભાવતા ભોજનની થાળી તૈયાર કરવાની હોય, તો તમે કયું ભોજન પસંદ કરશો?

---



---



---

હવે આપણો ચકાસીએ કે તમે તૈયાર કરેલ થાળીમાંથી આપણા શરીરને જરૂરી પોષક તત્ત્વો મળે છે? મધ્યાર્થ ભોજનમાં તૈયાર કરેલ થોડું ભોજન, એક વાડકીમાં લઈ આવો. તમે તમારી સાથે નાસ્તો લઈ આવ્યા છો? તેમાંથી થોડો નાસ્તો લઈ આવો.



**શું જોઈશો ?** તમે એકઠા કરેલા ખાદ્યપદાર્થના નમૂના, આયોડિન અને ડ્રોપર.

**શું કરીશું ?**

- ☛ ખાદ્યપદાર્થમાંથી કોઈ એક નમૂનો લો.
- ☛ તેના પર ડ્રોપરની મદદ વડે આયોડિનનાં બે-ત્રણ ટીપાં નાખો.
- ☛ ખાદ્યપદાર્થના રંગમાં કોઈ ફેરફાર થયો કે કેમ?
- ☛ આ રીતે દરેક ખાદ્યપદાર્થની ચકાસણી કરો.
- ☛ તમારું અવલોકન નીચેના કોષ્ટકમાં નોંધો.



ક્રમ	પદાર્થનું નામ	આયોડિનથી થતું રંગ પરિવર્તન

કાર્બોહાઇડ્રેટ (Carbohydrate) પદાર્થ પર આયોડિનનું ટીપું નાખવાથી તે વેરાશપડતા કાળા રંગનું બને છે. અહીં જે પદાર્થોના રંગમાં ફેરફાર થાય છે તેમાં કાર્બોહાઇડ્રેટની હાજરી છે તેમ કહી શકાય. નીચેના જેવા પદાર્થોમાંથી આપણાને કાર્બોહાઇડ્રેટ મળે છે.



- 1.
- 2.
- 3.
- 4.
- 5.
- 6.



ગણ્યા પદાર્થોમાં કાર્બોહાઇડ્રેટ હોય છે. પણ શું કાર્બોહાઇડ્રેટ ખરાવતો દરેક પદાર્થ ગણ્યો હોય છે ?

### કાર્બોહાઇડ્રેટનું મહત્વ :

કાર્બોહાઇડ્રેટ શરીરને જરૂરી શક્તિ પૂરી પાડે છે.



**શું જોઈશો ?** મગ, ચોખા, મગફળી, એરંડાનું બીજ, તલ, વરિયાળીનાં બીજ અને કાગળ.

### શું કરીશું ?

- જ દરેક બીજને વારાફરતી કાગળ પર ઘસો.
- જ કાગળનું અવલોકન કરી નીચેના કોષ્ટકમાં નોંધ કરો :

ઘસવાથી તેલ જેવા ડાઘ પડે છે તેવાં બીજ	ઘસવાથી તેલ જેવા ડાઘ પડતા નથી તેવાં બીજ

અહીં જે બીજને કાગળ પર ઘસવાથી તેલ જેવા ડાઘ પડે છે તે બીજ ચરબી ધરાવે છે તેમ કહી શકાય. ચરબીયુક્ત પદાર્થોની કષા હોય છે.

### ચરબીવાળા પદાર્થો :

સોયાબીન, રાઈ, અજભો, શીંગ, તજ, તલ, મહુડી, એરંડા, કપાસિયા, કાજુ, બદામ, લવિંગ, ધી, માખણ, તેલ અને મગફળી.

#### મહત્ત્વ :

- ચરબી શરીરમાં શક્તિ પૂરી પાડે છે.
- કોષ અને માંસપેશીઓની રચનામાં ચરબી મહત્ત્વનો ભાગ ભજવે છે.
- કાબોંદિતની સરખામણીમાં ચરબી બમણી કે તેથી વધુ શક્તિ ઉત્પન્ન કરે છે.
- શરીરને ગરમી પણ પૂરી પાડે છે.
- વધારાની ચરબી શરીરમાં જમા થાય છે, તેનો ઉપયોગ જરૂર પડે ત્યારે પોખરણ મેળવવામાં થાય છે.





**શું જોઈશો ?** ભગ, વાલ, વટાણા, ચણા, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ભિડાનાં બીજ, કોસ્ટિક સોડાનું દ્રાવણ, મોરથૂથુનું દ્રાવણ, પાણી અને ફોપર.


### શું કરીશું ?

- ૩ તમને આપવામાં આવેલાં બીજમાંથી એક બીજ લઈ તેનો ભૂકો કરો. તેના પર કોસ્ટિક સોડાના દ્રાવણના દસ્થી બાર ટીપાં નાંખો.
- ૪ ત્યારબાદ મોરથૂથુના દ્રાવણનાં બે-ત્રણ ટીપાં નાખી તમારું અવલોકન નીચેના કોષ્ટકમાં નોંધો. વારાફરતી દરેક બીજ સાથે આ પ્રક્રિયા કરી કોષ્ટકમાં નોંધો.

જાંબલી રંગ પરિવર્તન પામતાં બીજ	જાંબલી રંગ પરિવર્તન ન પામતાં બીજ

અહીં જાંબલી રંગ પરિવર્તન પામતાં બીજમાં પ્રોટીન (Protein) છે.

નીચેના ખાદ્યપદાર્થોમાંથી આપણાને પ્રોટીન મળી રહે છે.



દૂધ, પનીર, ઈડાં, માછલી, રાજમા અને દરેક દાળમાંથી પ્રોટીન મળે છે. સોયાબીનમાંથી પ્રોટીન વધુ માગામાં મળી રહે છે.

કઠોળ બાફીને ખાવાથી તેમાં રહેલું પ્રોટીન સુપાય્ય બને છે.

## મહત્ત્વ:

- કોષ અને પેશીના બંધારણ માટે જરૂરી છે.
- જૈવિક ડિયાઓનું નિયમન કરે છે.
- સ્નાયુઓના સંકોચન માટે જરૂરી છે.
- ચેપ સામે પ્રતિકારક શક્તિ આપે છે.
- અંતઃમાંવોના બંધારણ માટે જરૂરી છે.

**તમે ખાદ્યાં હોય અથવા જોયાં હોય તેવાં ફળોની અને લીલાં પાંડાંવાળાં શાકભાજુની ચાદી બનાવો.**

ફળો અને લીલાં પાંડાંવાળાં શાકભાજુની યાદી:

---



---



---




---



આ બધાં જ ફળો અને લીલાં પાંડાંવાળાં શાકભાજુભાં વિટામિન રહેલાં છે.

વિટામિન વિવિધ પ્રકારનાં હોય છે. તેનું પ્રાપ્તિસ્થાન, મહત્ત્વ અને તેની ઊંઘપથી થતા રોગો વિશેની માહિતી પાછળ આપેલાં કોષકમાં જણાવેલ છે.

વિટામિનનું નામ	શેમાંથી મળે છે ?	તેનું મહત્વ અને ઉપયોગ	ઉદ્દેશ્યી થતા રોગ
A વિટામિન 'એ'	ગાજર, લીલાં, પાંદડાવાળાં, શાકભાજી, માછલીના યકૃતનું તેલ (કોરલીવર ઓઈલ)	આંખો અને ત્વચાની જાળવણી માટે ઉપયોગી	આંખોના રોગો, ત્વચાના રોગો
B વિટામિન 'બી'	દૂધ, સોયાબીન, લીલાં, પાંદડાવાળાં, શાકભાજી, વટાણા, શીંગો, ઈડાં, માંસ, બટાટા, આખાં, ધાન્ય, ટબેટાં, મગફળી, કઠોળ	જૈવરાસાયાંકિક કિયાઓ માટે જરૂરી	બેરીબેરી
C વિટામિન 'સી'	આમળાં, લીંબુ, નારંગી, તથા અન્ય ખાટોં ફળો	રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી	ઝર્વા
D વિટામિન 'ડી'	દૂધ, માછલી, સૂર્યનાં, ક્રિકાંની વૃક્ષી	હાડકાંની વૃક્ષી માટે જરૂરી	સુક્તાન
E વિટામિન 'ઈ'	લીલાં પાંદડાવાળાં, શાકભાજી, દૂધ, માખણા, ટબેટાં	કોષોની અંદરતા જાળવવામાં	પાંહુરોગ
K વિટામિન 'કુ'	ચયાપચયની કિયાઓના સંશ્લેષણ દ્વારા	રક્તના સંવર્ધનમાં મદદ કરે છે.	યકૃતના રોગો થાય



તમે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવ તેવાં શાકભાજીની યાદી બનાવો.

---



---



---

આયર્ન, કેલ્લિયમ, મીઠું, પોટેશિયમ, આયોડિન વગેરે ખનીજ ક્ષારો છે. જે આપણને શાકભાજીમાંથી મળે છે. વિવિધ પ્રકારના ખનીજ ક્ષાર (Minerals), તેનું પ્રાપ્તિસ્થાન અને તેનું મહત્વ નીચેના કોષ્ટકમાં આપેલ છે :

ખનીજ ક્ષાર	ક્યા પદાર્થોમાંથી મળે છે	મહત્વ
કેલ્લિયમ	દૂધ, લીલાં શાકભાજી, છાશા, દહીં	હાડકાંના બંધારણમાં જરૂરી
લોહતત્વ	માંસ, સૂક્કમેવા, લીલાં પાંદડાવાળાં શાકભાજી	હિમોગલોબિનનું સંશોધણ કરે છે.
ફોસ્ફરસ	દૂધ, લીલાં પાંદડાવાળાં શાકભાજી	હાડકાંના ઘડતર માટે જરૂરી
સલ્ફર	લીલાં શાકભાજી, કુંગળી	શરીરની પેશીઓ અને માંસના ઘડતર માટે
આયોડિન	દરિયાઈ ખોરાક, આયોડિનયુક્ત મીઠું	ઉણપથી ગલગંડ (ગોઈટર) થાય છે.

### પાણી :

શરીરના વજનનો 60 ટકા ભાગ પાણીને આભારી છે. આપણને ખોરાક વગર થોડા દિવસ ચાલી શકે છે, પરંતુ પાણી વગર લાંબો સમય રહેવું શક્ય બનતું નથી..

સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવા માટે પાણી અત્યંત જરૂરી છે.

### મહત્વ :

- શરીરમાં ચાલતી જૈવરાસાયનિક કિયાઓ માટે જરૂરી છે.
- શરીરમાંના વાયુઓ, પોષકદ્રવ્યો તેમજ ઉત્સર્વદ્રવ્યોનું વહન કરે છે.
- શરીરનું તાપમાન જાળવી રાખે છે.

હવે તમે કહી શકશો

1) આપણે શા માટે વધુ પાણી પીવું જોઈએ ?

---



---



---

2) પાણી ન પીવાથી શું થશે ?

---



---



---

આમ, પોષણવિદ્યાને વૈજ્ઞાનિક દસ્તિએ તપાસીએ અને આપણો આહાર વૈજ્ઞાનિક દસ્તિકોણવાળો હોય તો જ સ્વાસ્થ્યપ્રદ જીવન વિતાવી શકાય. શરીરની સ્વસ્થતા એ તંદુરસ્ત જીવનનું પ્રથમ પગથિયું છે.

### સમતોલ આહાર (Balanced Diet) :

આપણે આ એકમાં ખોરાકનાં તત્ત્વો વિશે શીખી ગયા છીએ. તેના પરથી કહી શકાય કે જે આહાર કે ખોરાકમાં પ્રોટીન, ચરબી, કાર્બોહિટ, ખનીજક્ષારો, વિટામિન વગેરે તત્ત્વો આવેલાં હોય તેવા ખોરાકને સમતોલ આહાર કહેવાય. દૂધમાં ખોરાકનાં મોટાભાગનાં તત્ત્વો આવેલાં હોય છે તેથી દૂધને આપણે સંપૂર્ણ આહાર કહી શકીએ. માત્ર પ્રોટીનવાળો, માત્ર કાર્બોહિટવાળો, માત્ર ચરબીવાળો, માત્ર વિટામિનવાળો કે માત્ર ખનીજક્ષારવાળો ખોરાક આહારમાં લેવામાં આવે તો આપણે લાંબા સમય સુધી સ્વસ્થ રીતે જીવી ન શકીએ. લાંબા સમય સુધી અને તંદુરસ્ત રીતે જીવવા માટે સમતોલ આહાર લેવો જોઈએ. જેથી આપણા શરીરને જોઈએ તે ટલા પ્રમાણમાં જરૂરી તત્ત્વો મળી રહે. તમે બનાવેલા ભાવતા ભોજનની થાળીમાંથી કયાં કયાં પોષક તત્ત્વો મળી રહે છે, તે નક્કી કરો.

---



---



---

તમે ગઈકાલથી આજ સુધી ખાધેલ પદાર્થોની યાદી બનાવો.

---



---



---

તમે કરેલાં ભોજનને સમતોલ આહાર કહી શકશો? કારણ જણાવો.

---



---



---

### ગુટિજન્ય રોગો (Deficiency based Diseases) :

આપણા શરીરની તંદુરસ્તી માટે તેમજ શરીરમાં વિવિધ રોગ લાગુ ન પડે તે માટે સમતોલ આહાર જરૂરી છે. ખોરાક સમતોલ ન હોય તો શરીરને જરૂરી પોષક તત્ત્વોની ખોટ પડે. તેને કારણે શરીરમાં વિવિધ રોગ લાગુ પડે છે, જેને કુપોષણ કહી શકાય.

**ખોરાકમાંથી વિવિધ પ્રકારનાં જરૂરી પોષક તત્ત્વો શરીરને ન મળતાં  
જે રોગો થાય છે તેને ગુટિજન્ય રોગો કહે છે.**


આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં લાંબા સમય સુધી જો કોઈ પણ એક તત્ત્વની ઉણાપ હોય તો ગુટિજન્ય રોગો થાય છે. કયા તત્ત્વની ઉણાપથી કયા કયા રોગો થાય છે તે નીચેના કોષ્ટકમાં આપેલ છે.

પોષક તત્ત્વોની ઉણાપ	ગુટિજન્ય રોગ
પ્રોટીન	મેરેસ્મસ, ક્વોશિયોરકોર
આયોડિન	ગોઈટર
આયન	ઓનીમિયા
વિટામિન	રતાંધળાપણું, ઓનીમિયા, પેલાગ્રા, બેરીબેરી, સ્કર્વી, રિકેટ્સ, રક્તસાવ

શાળાના પુસ્તકાલયમાંથી 'આહાર અને આરોગ્ય' પુસ્તક મેળવી રોગો વિશેની વધુ માહિતી એકબ્ર કરો.



પ્ર.1 નીચે થાળીનું ચિત્ર આપેલું છે. તેમાં તમે ખોરાકનું નામ લખી ભોજન માટેની થાળી તૈયાર કરો અને નક્કી કરો કે તે સમતોલ આહાર છે?



પ્ર.2 તમારી ભોજનની વાનગીઓની અઠવાડિયાની રૂપરેખા તૈયાર કરો.

દિવસ	ખોરાક
સોમવાર	
મંગળવાર	
બુધવાર	
ગુરુવાર	
શુક્રવાર	
શનિવાર	
રવિવાર	